https://archive.org/details/bk1153/page/n0/mode/1up

2005 After -Modasa Umiya Mataji Mandir -Shwet Patra (1153)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

0

શ્રી કચ્છ કડવા પાટીદાર ઉમિયા મંદિરની સત્ય હકીકત, મોડાસા.

"શ્વેત પત્ર"

વર્ષો પહેલાં ચાલીસેક પરિવાર ધંધાર્થે મોડાસા નગરમાં સ્થાયી થયેલા મોડાસા મુકામે આશરે ૭૨ કંપાના ગોળની સમાજવાડી આવેલી છે. મોડાસામાં રહેતા આપણા સમાજના પરિવારોને પોતાના સામાજીક તેમજ ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે આ સમાજવાડી વાપરવા માટે ન આપવાના પ્રશ્નો ઉપસ્થીત થયેલ જેના કારણે મોડાસામાં વસવાટ કરતા પરિવારોને વાડી બનાવવાની જરૂરિયાત ઉભી થઈ. આ સમય દરમ્યાન આનંદપુરાકંપાવાળા શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ ચોપડા પોતાની માલિકીની જમીન સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી ૨ એકર ૨૦ ગુંઠા મેઘરજ રોડ-મોડાસા વેચવાની છે. તેવી માહિતી શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના વડીલોને મળતા શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ ચોપડા આનંદપુરા વાળાનો સંપર્ક કરતાં નારણબાપા એ ચર્ચાના અંતે બે લાખ રૂપિયામાં જમીન વેચાણ આપવાનું કહેલ. જેના પેટે એક લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયા "શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ પટેલ ભોજનવાડી" નામ કરણના મજરે આપવાનું નક્કી કરવામાં આવેલ તેઓએ નામ કરણનું સંમત્તિ પત્રક શ્રી શામજીભાઈ અરજણભાઈ દેશાઈપુરાવાળા તેમજ અખઈભાઈ લધાભાઈ કરસનપુરા વાળાની સાક્ષીએ પ્રગિતી મંડળને લખી આપેલ છે. તે વખતે રૂપિયા ૬૦ હજાર તેઓએ લઈને પહોંચ લખી આપેલ. તેમાં પણ ઉપરોક્ત બન્ને સાક્ષીઓની સહીઓ કરેલ છે અને ૪૦ હજાર રૂપિયાની પ્રોમીસરી નોટ લખી આપવાની હતી. તા. ૧૭/૧/૧૯૮૩ ના રોજ સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી ૨ એકર ૨૦ ગુંઠા જમીનનો શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના નામનો દસ્તાવેજ સબ રજીસ્ટાર કચેરી મોડાસામાં રજુ કરવામાં આવ્યો નારાણબાપા આનંદપુરા કંપા ગયા ત્યાં કોઈ કે ગેરમાર્ગે દોર્યા અને આ સદરહુ જમીન પ્રગતી મંડળને આપી છે તે વાતમાં ફેરવી તોળ્યું અને મે જમીન મોડાસા સમાજને આપી છે. તેવું જણાવતા જેથી પ્રગતિ મંડળે પોતાની વાડી બનાવવા બીજી જમીન ખરીદી અને જરૂરિયાત પુરતી ભોજનવાડી બનાવી દીધી જે ઉમિયા ચોકના નામે ઓળખાય છે.

સદરહુ દસ્તાવેજ માંથી પ્રગતી મંડળનું નામ કાઢી નાખતા મંડળે કહેલ કે અમે આપેલ ૬૦ હજાર રૂપિયાનું ગમેત્યાં બોર્ડ ચઢાવજો. આમ ૧૯૮૩ ની સાલથી ૧૯૯૫ની સાલ સુધી આ જમીન એમને એમ પડી રહેલ. સમાજની વિદ્યાર્થી બોર્ડીગ, કન્યા છાત્રાલય, હાઈસ્કુલ વગેરે બનાવવાની ખુબ મોટી જવાબદારી હોઈ મંડળને બોલાવીને કચ્છ કડવા પાટીદાર સમાજની જનરલ સભામાં સદરહુ સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી જમીન પ્રગતી મંડળ સંભાળે અને નિભાવે તેમજ સંકુલ ઉભુ કરે તેવી જવાબદારી સોંપવામાં આવી. પરંતુ પહેલા દસ્તાવેજમાંથી પ્રગતિ મંડળનું નામ નીકળી ગયું, ફરી સાથે રહીને સંકુલ બનાવતાં આવનાર દિવસોમાં ફરી મંડળને કાઢી નખવામાં નહિ આવે તેની ખાત્રી શું ? એટલે સમાજ અને પ્રગતિ મંડળ વચ્ચે ૧૯૯૫ થી ૧૯૯૭ સુધી વાટાઘાટોના અંતે ૧૭ મુદાઓ સર્વ સંમતિથી નક્કી થયા અને જેમાં સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી ના સહી સીક્કા થયા અને પ્રગતિ મંડળના પ્રમુખ તેમજ મંદિરના પ્રમુખના સહી સીક્કા થયા. આમ મંડળને સદરહુ મુદ્દાને આધારે જવાબદારી સોંપવામાં આવી જેમાં મોટા ભાગના નાણાં પ્રગતી મંડળના હોવાથી મંડળ માટે વાડી બનાવવાની હતી, મંડળે ઉપયોગ કરવાનો હતો. સર્વસંમતિથી આઠ સભ્યો મંડળના અને ત્રણ સભ્યો મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ, મોડાસા વિભાગના અને એક નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળા જે નામ કરણના દાતા છે.તેમને આજીવન સભ્ય ગણવા તેવું નક્કી કરવામાં આવેલ.

આવું નક્કી થતાં પ્રગતી મંડળના સભ્યો બે લકઝરી બસ લઈને ઊંઝા મુકામે જઈ મિટીંગ ભરી રૂપિયા ૧૦ લાખ જેવો ફાળો નોંધી સદરહુ જમીન પર કામ શરૂ કરવાના શ્રી ગણેશ કરેલ. શરૂઆતમાં સદરહુ કચ્છ કડવા પાટીદાર સમાજના નક્કી કરેલ ત્રણ સભ્યો પૈકી (૧) શ્રી ગંગારામભાઈ નાનજીભાઈ (૨) શ્રી હરિભાઈ વાલજીભાઈ (૩) શ્રી હંસરાજભાઈ રવજીભાઈ તા. ૪/૯/૧૯૯૫ ની કારોબારી મિટીંગમાં નક્કી થયા.

આમ ઉપરોક્ત સભ્યો કચ્છ કડવા પાટીદાર સમાજની જનરલ સભાએ ચુંટીને મોકલેલા છતાં પણ સતપંથી ભાઈઓ કહેતા હોય કે અમે જાણતા નથી. તો એ કેટલી વાત વ્યાજબી માનવી ?

પ્રગતિ મંડળને જવાબદારી ૧૭ મુદ્દાના કરારથી આપી એટલે મંડળજ વહીવટ કરે છે તેવું નથી. સમાજના ત્રણ સભ્યોની સંમતિ સાથે રાખીને વહીવટ કરે છે. સમાજ અને મંડળની નિયુક્ત કમિટી દ્વારા સમાજને સાથે રાખીને પ્લાન એસ્ટીમેટ બનાવડાવેલ પ્લાન પ્રમાણે બાંધકામ મજુરી કામના ટેન્ડરો મંગાવી કોન્ટ્રાકટ આપી બાંધકામ શરૂ કરવામાં આવેલ તા. ૭/૫/૯૯ ના રોજ ભૂમી પૂજન કરી બાંધકામ શરૂ થતાં આપણી સંસ્થા નામે કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ બનાવી રજીટ્રેશન માટે વિચારવામાં આવ્યું જેમાં હંસરાજભાઈ ગોવિંદભાઈ - સબલપુર, વિઠ્ઠલભાઈ રતનસિંહભાઈ - મોડાસા, રમણભાઈ કરશનભાઈ - મોડાસા,

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1153/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk1153/page/n2/mode/1up

realpatidar.com

શ્રી કચ્છ કડવા પાટીદાર ઉમિયા મંદિરની સત્ય હકીકત, મોડાસા.

"શ્વેત પત્ર"

વર્ષો પહેલાં ચાલીસેક પરિવાર ધંધાર્થે મોડાસા નગરમાં સ્થાયી થયેલા મોડાસા મુકામે આશરે ૭૨ કંપાના ગોળની સમાજવાડી આવેલી છે. મોડાસામાં રહેતા આપણા સમાજના પરિવારોને પોતાના સામાજીક તેમજ ધાર્મિક પ્રસંગો ઉજવવા માટે આ સમાજવાડી વાપરવા માટે ન આપવાના પ્રશ્નો ઉપસ્થીત થયેલ જેના કારણે મોડાસામાં વસવાટ કરતા પરિવારોને વાડી બનાવવાની જરૂરિયાત ઉભી થઈ. આ સમય દરમ્યાન આનંદપુરાકંપાવાળા શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ ચોપડા પોતાની માલિકીની જમીન સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી ૨ એકર ૨૦ ગુંઠા મેઘરજ રોડ-મોડાસા વેચવાની છે. તેવી માહિતી શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના વડીલોને મળતા શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ ચોપડા આનંદપુરા વાળાનો સંપર્ક કરતાં નારણબાપા એ ચર્ચાના અંતે બે લાખ રૂપિયામાં જમીન વેચાણ આપવાનું કહેલ. જેના પેટે એક લાખ રૂપિયા રોકડા અને એક લાખ રૂપિયા "શ્રી નારાણભાઈ વિશ્રામભાઈ પટેલ ભોજનવાડી" નામ કરણના મજરે આપવાનું નક્કી કરવામાં આવેલ તેઓએ નામ કરણનું સંમત્તિ પત્રક શ્રી શામજીભાઈ અરજણભાઈ દેશાઈપુરાવાળા તેમજ અખઈભાઈ લધાભાઈ કરસનપુરા વાળાની સાક્ષીએ પ્રગિતી મંડળને લખી આપેલ છે. તે વખતે રૂપિયા ૬૦ હજાર તેઓએ લઈને પહોંચ લખી આપેલ. તેમાં પણ ઉપરોક્ત બન્ને સાક્ષીઓની સહીઓ કરેલ છે અને ૪૦ હજાર રૂપિયાની પ્રોમીસરી નોટ લખી આપવાની હતી. તા. ૧૭/૧/૧૯૮૩ ના રોજ સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી ૨ એકર ૨૦ ગુંઠા જમીનનો શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળના નામનો દસ્તાવેજ સબ રજીસ્ટાર કચેરી મોડાસામાં રજુ કરવામાં આવ્યો નારાણબાપા આનંદપુરા કંપા ગયા ત્યાં કોઈ કે ગેરમાર્ગે દોર્યા અને આ સદરહુ જમીન પ્રગતી મંડળને આપી છે તે વાતમાં ફેરવી તોળ્યું અને મે જમીન મોડાસા સમાજને આપી છે. તેવું જણાવતા જેથી પ્રગતિ મંડળે પોતાની વાડી બનાવવા બીજી જમીન ખરીદી અને જરૂરિયાત પુરતી ભોજનવાડી બનાવી દીધી જે ઉમિયા ચોકના નામે ઓળખાય છે.

સદરહુ દસ્તાવેજ માંથી પ્રગતી મંડળનું નામ કાઢી નાખતા મંડળે કહેલ કે અમે આપેલ ૬૦ હજાર રૂપિયાનું ગમેત્યાં બોર્ડ ચઢાવજો. આમ ૧૯૮૩ ની સાલથી ૧૯૯૫ની સાલ સુધી આ જમીન એમને એમ પડી રહેલ. સમાજની વિદ્યાર્થી બોર્ડીંગ, કન્યા છાત્રાલય, હાઈસ્કુલ વગેરે બનાવવાની ખુબ મોટી જવાબદારી હોઈ મંડળને બોલાવીને કચ્છ કડવા પાટીદાર સમાજની જનરલ સભામાં સદરહુ સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી જમીન પ્રગતી મંડળ સંભાળે અને નિભાવે તેમજ સંકુલ ઉભુ કરે તેવી જવાબદારી સોંપવામાં આવી. પરંતુ પહેલા દસ્તાવેજમાંથી પ્રગતિ મંડળનું નામ નીકળી ગયું, ફરી સાથે રહીને સંકુલ બનાવતાં આવનાર દિવસોમાં ફરી મંડળને કાઢી નખવામાં નહિ આવે તેની ખાત્રી શું ? એટલે સમાજ અને પ્રગતિ મંડળ વચ્ચે ૧૯૯૫ થી ૧૯૯૭ સુધી વાટાઘાટોના અંતે ૧૭ મુદાઓ સર્વ સંમતિથી નક્કી થયા અને જેમાં સમાજના પ્રમુખશ્રી, મંત્રીશ્રી ના સહી સીક્કા થયા અને પ્રગતિ મંડળના પ્રમુખ તેમજ મંદિરના પ્રમુખના સહી સીક્કા થયા. આમ મંડળને સદરહુ મુદ્દાને આધારે જવાબદારી સોંપવામાં આવી જેમાં મોટા ભાગના નાણાં પ્રગતી મંડળના હોવાથી મંડળ માટે વાડી બનાવવાની હતી, મંડળે ઉપયોગ કરવાનો હતો. સર્વસંમતિથી આઠ સભ્યો મંડળના અને ત્રણ સભ્યો મોડાસા કચ્છ કડવા પાટીદાર સમાજ, મોડાસા વિભાગના અને એક નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળા જે નામ કરણના દાતા છે.તેમને આજીવન સભ્ય ગણવા તેવું નક્કી કરવામાં આવેલ.

આવું નક્કી થતાં પ્રગતી મંડળના સભ્યો બે લકઝરી બસ લઈને ઊંઝા મુકામે જઈ મિટીંગ ભરી રૂપિયા ૧૦ લાખ જેવો ફાળો નોંધી સદરહુ જમીન પર કામ શરૂ કરવાના શ્રી ગણેશ કરેલ. શરૂઆતમાં સદરહુ કચ્છ કડવા પાટીદાર સમાજના નક્કી કરેલ ત્રણ સભ્યો પૈકી (૧) શ્રી ગંગારામભાઈ નાનજીભાઈ (૨) શ્રી હરિભાઈ વાલજીભાઈ (૩) શ્રી હંસરાજભાઈ રવજીભાઈ તા. ૪/૯/૧૯૯૫ ની કારોબારી મિટીંગમાં નક્કી થયા.

આમ ઉપરોક્ત સભ્યો કચ્છ કડવા પાટીદાર સમાજની જનરલ સભાએ ચુંટીને મોકલેલા છતાં પણ સતપંથી ભાઈઓ કહેતા હોય કે અમે જાણતા નથી. તો એ કેટલી વાત વ્યાજબી માનવી ?

પ્રગતિ મંડળને જવાબદારી ૧૭ મુદ્દાના કરારથી આપી એટલે મંડળજ વહીવટ કરે છે તેવું નથી. સમાજના ત્રણ સભ્યોની સંમતિ સાથે રાખીને વહીવટ કરે છે. સમાજ અને મંડળની નિયુક્ત કમિટી દ્વારા સમાજને સાથે રાખીને પ્લાન એસ્ટીમેટ બનાવડાવેલ પ્લાન પ્રમાણે બાંધકામ મજુરી કામના ટેન્ડરો મંગાવી કોન્ટ્રાકટ આપી બાંધકામ શરૂ કરવામાં આવેલ તા. ૭/૫/૯૯ ના રોજ ભૂમી પૂજન કરી બાંધકામ શરૂ થતાં આપણી સંસ્થા નામે કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ બનાવી રજીર્ટ્રેશન માટે વિચારવામાં આવ્યું જેમાં હંસરાજભાઈ ગોવિંદભાઈ - સબલપુર, વિઠ્ઠલભાઈ રતનસિંહભાઈ - મોડાસા, રમણભાઈ કરશનભાઈ - મોડાસા,

realpatidar.com

realpatidar.com

છગનભાઈ કરમશીભાઈ - આનંદપુરા કંપાવાળા વગેરે એ સંસ્થાનું બંધારણ બનાવી મંજૂર કરાવી સદરહુ નામે ટ્રસ્ટ રજીસ્ટર કરાવેલ જેને સમાજની જનરલ સભામાં વંચાણે લઈ મંજુર કરવામાં આવેલ. આમ મંદિરનું બાંધકામ પૂર્ણતાને આરે આવતા પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે વિચારવામાં આવતાં પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માટે ૩૦ સભ્યોની સુપર કમિટી બનાવવામાં આવી જેના પ્રમુખ તરીકે શ્રી છગનભાઈ કરમશીભાઈ આનંદપુરાવાળા ને બનાવવામાં આવ્યા અને જનરલ સભાએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ૮/૨/૨૦૦૬ થી ૧૦/૨/૨૦૦૬ સુધી નક્કી કરવામાં આવેલ. ત્યાર બાદ શ્રી ઉમિયા માતાજી મંદિરની મુર્તિઓ તથા શિવ મંદિરની મુર્તિઓનો જયપુર મુકામે ઓર્ડર આપેલ.

પત્રિકાઓ છપાવવાનું થતાં સંતોને આમંત્રણ આપવા માટે સમાજના વડિલો દ્વારા ૧૮/૧૨/૨૦૦૫ ના રોજ મહાદેવપુરા કંપા પધારેલ પ.પૂ. શ્રી પ્રેમદાસબાપુને રૂબરૂ આમંત્રણ આપી પીરાણા મુકામે પ.પૂ. શ્રી નાનકદાસજી મહારાજને આમંત્રણ આપી વળતાં વેદાંતઆશ્રમ વલાદ પ.પૂ. શ્રી શિવાનંદ તીર્થને આમંત્રણ આપી આવ્યા. ત્યાર બાદ આજ વડીલોએ તા. ૧૯/૧૨/૨૦૦૫ ની સુપર કમિટીની મિટીંગમાં તારીખ ૧૭/૧૨/૨૦૦૫ ની આવેલ નનામી અરજીને પ્રાધન્ય આપીને સંતોને આમંત્રણ આપેલ હોવા છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અટકાવવાનો હિન પ્રયાસ કરેલ.

તા. ૧૭/૧૨/૨૦૦૫ ની મિટીંગમાં કેટલાક ભાઈઓ એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા આયોજન માટે બોલાવેલ જેમાં ૬૫ ભાઈઓ હાજર રહેલ. આ મિટીંગમાં સમજદાર ભાઈઓએ જણાવેલ કે આ મિટીંગ બોલાવેલ છે તો તેમાં સુપર કમિટીના કોઈ હોદ્દેદારો નથી તો શા માટે પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવના બહાના નીચે બોલાવવામાં આવી ? ત્યારે સતપંથના ભાઈઓ એ કહેલ કે મંડળ અને સમાજ વચ્ચે થયેલ ૮/૩ મુદ્દા બાબતે આ મુદ્દો કાઢી નાખી બંધારણ બદલી સમગ્ર સમાજનું થવુ જોઈએ, મંડળ ન જોઈએ આ મિટીંગથી જ સમાજ ને તોડી પાડવા જેવું અધમ કૃત્યના શ્રી ગણેશ થયા. નનામી અરજી સાથે ૬૫ વ્યક્તિઓની સહી વાળો કાગળ જે અમે ફક્ત આ મિટીંગમાં હાજરીની જ સહીઓ કરેલ છે. અમે ૮/૩ ના મુદ્દાને કાઢવા સહમત નથી તેમજ આ બાબતે આગળ વધવુ તદ્દન અયોગ્ય છે. જેથી આ અરજી બાબતે કોઈપણ કાર્યવાહી થવી ન જોઈએ. આવાં હિન તત્વોએ ખુલ્લે આમ જણાવેલ કે ઉમિયા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય કે ન થાય તેની અમને પરવા નથી પરંતુ ૮/૩ નો મુદ્દો અમે કાઢીને જંપીશું.

આ અનુસંધાને સુપર કમિટીના જવાબદાર વ્યક્તિઓ એ પણ નનામી અરજીને બિન જરૂરી મહત્વ આપી સદરહુ ટ્રસ્ટનું બંધારણ કેમ ન બદલાય ? આ વાત ને તેમના મળતીયા નનામી અરજી કરવાવાળા ભાઈઓ ને સમર્થન આપેલ ત્યારથી ઉમિયામાતાજીની પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્ય ખોરંભે પડેલ છે.

ત્યાર બાદ નનામી અરજી કરનાર ભાઈઓએ પોતાની રીતે અમુક કંપાઓમાં જઈ ૧૫ થી ૨૦ મિટીંગો ભરી તેમાં ખોટી રીતે રજુઆત કરી સંપ્રદાય વાદ જગાડયો અને સાચી વાત છુપાવીને ખોટા ભ્રામક પ્રગતી મંડળ વિરોધ પ્રચાર કર્યો. એક્ય અને સુમેળથી રહેતા આ સમાજમાં તીરાડ પાડવાનું હિન કૃત્ય કોણે કર્યું ?

અત્યાર સુધીમાં ટ્રસ્ટ ઉપર જે કંઈ કેશો કરવામાં આવેલ છે તે કોણે કર્યા ? અને એક કેશ નો ટ્રસ્ટે જવાબ આપવાનો થાય તે પહેલાં અન્ય બીજો કેશ આ ભાઈઓ દ્વારા મુકવામાં આવેલ છે. જે આજે પણ આપણે જે મા ઉમિયાના ખોળામાં શ્રી લીક્ષ્મીનારાયણ ધર્મ જાગૃતિ રથનું આગમન તેમજ ધર્મસભા યોજવાનું નક્કી થયેલ હતું પણ પરષોત્તમ હિરજી કરસનપુરાવાળા એ આ રથની શોભા યાત્રા ન નીકળે તેમજ ધર્મ સભાનું આયોજન ન થાય તેવી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં તેમજ ડેપ્યુટી કલેકટર શ્રી ને ત્યાં અરજી આપી મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા પ્રગતી મંડળના ભાઈઓ તેમજ સનાતન સમાજના પ્રમુખશ્રી વગેરે કુલ ૧૫ ભાઈઓ સામે ચેપ્ટર કેસ કર્યા. શ્રી લક્ષ્મીનારાયણ જાગૃતિ રથ તેમજ ધર્મસભા, લોક ડાયરો, વગેરે કાર્ય ક્રમો તારીખ ૨૪ અને ૨૫ જાન્યુઆરી ૨૦૦૯ ના રોજ મંદિરવાળી સર્વે નંબર ૪૯૪/૧/૨ વાળી જગ્યાએ વાંધાંઓ રજુ કરી સદર જગ્યા પર કાર્યક્રમ ન કરવા હિન કૃત્ય કર્યું તે કેટલે અંશે વ્યાજબી છે ?

આ ઉપરાંત પત્રિકા છપાવીને સમાજને ગેરમાર્ગે દોરવાનું હિન કૃત્ય કરેલ છે. જેની સત્યતા નીચે મુજબ છે.

૧. શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળાએ જમીન વેચાણ આપેલ છે. સમગ્ર સમાજને ગેરમાર્ગે દોરી પોતાના તરફ લાગણી જગાડવાના બદ ઈરાદાથી જમીન દાનમાં આપી છે તેવા અપ્રચાર કરવામાં આવે છે.

ટ્રસ્ટ રજીસ્ટ્રેશન વખતે તેના પરિશિષ્ઠમાં (સભાસદ યાદીમાં) પુરપુરૂં નામ સરનામું શ્રી નારણભાઈ વિશ્રામભાઈ આનંદપુરા કંપાવાળા અને તેમની સહી કરેલ છે. છેલ્લા સાત વર્ષથી મે. ચેરીટી કમિશ્નર તથા ઈન્કમટેક્ષ વિગેરેમાં ટ્રસ્ટીઓની યાદીમાં શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળા લખાય છે. ટ્રસ્ટની મિટીંગના એજન્ડા શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળા ના નામથી જ મોકલવામાં આવે છે. બંધારણ મુજબ દર બે વર્ષે કારોબારી કમિટી બદલાય છે. તેના ઠરાવોમાં પણ શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળા લખાયેલ છે.

realpatidar.com

realpatidar.com

નારણભાઈ વિશ્રામભાઈ પટેલ કે જેઓ ટ્રસ્ટના સભાસદ છે. જેઓ ગાયત્રી સોસાયટીમાં મોડાસા ખાતે રહે છે. તેવું છેતરપિંડી કરી ભળતા નામ વાળાના નામથી એજન્ડા મોકલી શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ આનંદપુરા કંપાવાળાનું નામ કાઢી નાખવા માગે છે. તેવી દલીલ કરે છે. પરંતુ શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ ગિતાંજલી સોસાયટીમાં રહેતાં જ નથી. આવા નામ વાળા શ્રી નારણભાઈ વિશ્રામભાઈ પટેલ ગાયત્રી સોસાયટીમાં રહે છે. જો નામ બદલવાનો ઈરાદો હોત તો ગિતાંજલી સોસાયટીની જગ્યાએ ગાયત્રી સોસાયટી લખેલ હોત. પરંતુ માત્ર એક જ જગ્યાએ સ્લીપ ઓફ પેનથી આનંદપુરા કંપાની જગ્યાએ ગીતાંજલી સોસાયટી, મોડાસા લખાયેલ છે. જેની યોગ્ય ખુલાસાથી ચર્ચા સંતપંથી ભાઈઓ અને સનાતન ભાઈઓ વચ્ચે ૨૫ વ્યક્તિઓની મિટીંગ કુમાર છાત્રાલયના હોલમાં રાખી એજન્ડાબુક, ઠરાવબુક, સભ્યપદ બુક, મે. ચેરીટી કમિશ્નરમાં મોકલાવેલ ઓડિટ રિપોર્ટ સાથે, ઈન્કમટેક્ષમાં મોકલેલ રિર્ટન સાથે વગેરે તમામ દસ્તાવેજોની આ કમિટીએ ચકાસણી કરી અને ખરેખર આ સ્લિપ ઓફ પેનથી થયેલ છે તેવું નક્કી થયું અને આ બાબતે વિસ્તૃત છણાવટ કરી આ વિષયની ફરી ચર્ચનો વિષય બનાવવો નહિ તેવું નક્કી કરવામાં આવ્યું તેમ છતાં કાગનો વાઘ કરી આવી ભ્રામક પત્રીકાઓ દ્વારા સમાજને ગેરમાર્ગે દોરવાનું કાર્ય નથી તો બીજુ શું છે ?

૨. ૮/૩ ના મુદ્દાની રચના સમાજ અને પ્રગતિ મંડળ બન્ને એક-બીજાની સર્વ સંમતિથી નક્કી કરેલ હોઈ તેમાં ફેરફાર કરવો નહિ અને કરવો હોય તો તેના પ્રમાણમાં જ કરવો તેવું નક્કી થયેલ છે. જેને લોકસાહી ઢબનું જ કહેવાય.

૩. તારીખ ૧૯/૧૨/૨૦૦૫ ની સુપર કમિટીમાં નનામી અરજી આવ્યા બાદ કંપાઓમાં સનાતની ભાઈઓને દૂર રાખી સતપંથી ભાઈઓની અસંખ્ય મિટીંગો ભરવાના કારણે જ સનાતન સમાજની રચના કરવાની જરૂરીયાત ઉભી થઈ.

સનાતન સમાજની રચના કરવામાં આવી કેમ કે શ્રી ઉમિયા માતાજી મંદિરની પરાણ પ્રતિષ્ઠા નક્કી થયા પછી તેના આયોજન માટેની સુપર કમિટીની રચના કરી તમામ પ્રકારના દાતાઓ જેવા કે ભોજન, મંડપ, હવન કુંડ, વગેરે ની જાહેરાત જનરલ સભામાં નક્કી થઈ ત્યાર પછી અમુક સતપંથી ભાઈઓના બદ ઈરાદાથી સતપંથીના કંપાઓમાં ખોટા મુદ્દાઓ ઉપર ઉશ્કેરણી જનક મિટીંગો ભરવામાં આવી તેમાં જાણવા મુજબ ખાનગી રાહે ૧૫ થી ૨૦ જેટલી મિટીંગો કરી સમાજના બે ભાગ પાડવાનું શરમ જનક કૃત્ય કરી તેમણે જ શરૂઆત કરેલ. આ બાબતની જાણ સનાતન ભાઈઓને થતાં તેમણે પણ મોડાસા પ્રગતિ મંડળ સાથે બેસીને આ ખાનગી મિટીંગોનું તથ્ય શું છે ? તે જાણવા માટે ભેગા થયેલ જે અનુસંધાનમાં બીજી મિટીંગમાં સનાતન સમાજની રચના કરવામાં આવી.

આપણા સમાજ અને પ્રગતિ મંડળ વચ્ચે થયેલ સમજુતીમાં કોઈપણ મડાગાંઠ પડે તો પરસ્પર સમજુતીથી ઉકેલ કરવો અને કોઈએ કોર્ટ કચેરીમાં જવું નહિ. તેમ છતાં મે. ચેરીટી કમિશ્નરમાં કેસ કરવાની શું જરૂરીયાત ઉભી થઈ ? કેસ કરનાર કોણ ? અને કંપાઓમાં એક તરફી મિટીંગોની શરૂઆત કરનાર કોણ ? જેને લઈને કંપાઓના સનાતનના ભાઈઓ આવાતથી અજાણ હોઈ સામુહીક રીતે ભેગા થઈ સનાતન સમાજનું સંગઠન કરી અને આ પ્રશ્ન અંગે પ્રગતી મંડળના ભાઈઓને પુછ્યુ કે સદર કેસમાં સ્થિતી શું છે ? તે અમને જણાવો. જેથી સત્ય હકિકત સનાતના ભાઈઓએ જાણી અને સંગઠિત થઈ સનાતન સમાજની રચના કરવામાં આવી તેમાં ખોટુ પણ શું છે ? મા ઉમિયાની આરતી સવાર - સાંજ જે થાય છે . તે કેસ થતાં અગાઉ થી મંદિર ખંડેર ન બને તે માટે અને સાફ સુફ રહે તે શુભ આશયથી આરતી શરૂ કરેલ છે.

૪. પ્રગતી મંડળમાં રહેલા સતપંથી ભાઈઓના વિરોધમાં પત્રિકા છાપનાર સતપંથી પણ હોઈ શકે. કેમ કે જે સતપંથી ભાઈઓ હોવા છતાં સત્ય હકીકત માટે સનાતની ભાઈઓની તરફેણમાં હતા ને સતપંથી તરફ નીષ્ક્રિય હતા તેઓના નામ લખી તેમને ઉશ્કેરવા માટે લખી હોય તેવુ જણાય છે.પત્રિકાના લખાણ ઉપરથી જણાય છે કે ૨૫ મો રોજો પાડે છે આ છુપી વાતની સનાતની ભાઈઓને લેશ માત્ર ખ્યાલ નહિ હોય અને સનાતની આવુ કામ કરે જ નહિ.

૫. શ્રી હરજીભાઈ લાલજીભાઈ પટેલ માર્ગ નામનું બોર્ડ મોડાસા નગરપાલિકા દ્વારા મુકવામાં આવેલ અને તેમના દ્વારા જ ઉતારવામાં આવેલ છે માટે તેનો સત્ય જવાબ મોડાસ નગરપાલિકા જ આપી શકે તેમ છે.

૬. સનાતન સમાજની રચના કરવી એ સનાતની ભાઈઓના અબાધિત અધિકાર છે. એ અધિકાર ઉપર સતપંથી ભાઈઓને તરાપ મારવાનો કોઈ અધિકાર નથી. ભારત લેવલે અનેક સનાતન સમાજો તેમજ સતપંથી સમાજો વર્ષોથી અસ્તીત્વ ધરાવે છે. આવાં સંકુચિત વિચારો છોડી વિશાળ હૃદયના માનવિ કયારે બનશો ?

સનાતન સમાજે પ્રથમ સ્નેહમિલન કરેલ તેને જો શક્તિ પ્રદર્શન ગણાવતા હોય તો તે તેમનું બુધ્ધિનું પ્રદર્શન કરતાં હોય તેવુ લાગે છે. શક્તિ પ્રદશન જ કહેવુ હોય તો નહેરૂકંપા શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરની પ્રાણ પ્રતીષ્ઠા નહેરૂકંપામાં થતી હોય જે સ્થળ મોડાસાથી ૨૫ કિમી દૂર હોવા છતાં મોડાસાથી શોભાયાત્રા કાઢી શક્તિ પ્રદર્શન કોની સામે કર્યું ? આવી અનેક શોભા યાત્રાઓ કોની સામે થઈ ?

૭. આનંદપુરા કંપા શ્રી નિષ્કલંકી નારાયણ મંદિરની પ્રાણ પ્રતીષ્ઠામાં મોડાસાથી તેમજ આજુબાજુના ગામો માંથી અનેક સનાતની

realpatidar.com

realpatidar.com

ભાઈઓ પણ આનંદપુરા કંપા ગયેલ અને ખૂબજ ધામ ધુમથી પ્રશંગની ઉજવણીમાં હર્ષભેર ભાગ લીધેલ આ બાબતે બહિષ્કારનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી આ પ્રશ્ન ઉપસ્થિત કરવા શું ઈરાદો છે ?

૮. રૂપાલકંપા મુકામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતીષ્ઠા મહોત્સવ દરમ્યાન સંતોશ્રીઓ એ જે કંઈ કહ્યું તે શ્રી ઉમિયા માતાજી મંદિર મોડાસાની પ્રાણ પ્રતિષ્ઠા અટકાવાઈ છે જેઓ અત થી ઈતી સુધીનો તમામ ઈતિહાસ તેઓ સંપૂર્ણ પણે જાણતા હોઈ તેમની લાગણી દુભાઈ હોઈ કુટુંબનો જ વ્યક્તિ કુટુંબને મારે તેવું દેખાતુ હોઈ તેમના અંતર આત્માથી સ્ફૂરેલ સત્ય વાણી હતી નહિ કે ઉશ્કેરણી. પણ જેમને આંખમાં પિળીયો હોય તેમને બધુ પીળુ જ દેખાય. આ વાત તે પત્રિકા દ્વારા સિધ્ધ થાય છે.

૯. વડાગામ ખાતે નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિરની પ્રાણ પ્રતીષ્ઠામાં ખોટી માહિતી કે ઉશ્કેરવાના કે બહિષ્કાર કરવાનો પ્રશ્ન જ નથી પણ દરેકે પોતાના અંતર આત્માના અવાજ ને ઓળખીને વર્તન કરેલ છે.

૧૦. શ્રી એચ.એલ. પટેલ સરસ્વતિ વિદ્યાલય મોડાસામાં વહીવટ પારદર્શક ચાલતો હોય તો પારદર્શક કોને કહેવાય તેની વ્યાખ્યા સમજવાની જરૂરી છે.

જો લોકશાહી ઢબે વહીવટ ચાલતો જ હોય તો શા માટે નવા સભ્યો બનાવવામાં આવતા નથી ?

સભ્ય થવા ઈચ્છા ધરાવનાર વ્યક્તિઓને સભ્યો બનાવવામાં આવતા નથી અને પાછલા બારણે મળતીઆ ઓને રાતોરાત સભ્ય બનાવવામાં આવે છે તો આ વહીવટ કેવો આપ ખુદશાહી ? સગાવાદ કે લાગવગશાહી ?

ઉમા કેળવણી મંડળની સામાન્ય સભામાં વિરોધ હોવા છતાં સભ્ય ફિ માં વધારો શા માટે કરવામાં આવે છે ?

૧૧. આટલું ઓછું હોય તેમ શ્રી લક્ષ્મીનારાયણ જાગૃતિ રથના આગમન વખતે માતાજીની ચુંદડી સ્વરૂપે મંદીર ઉપર કરેલ રોશની માટે પણ વાંધો કોને કર્યો ?

વધુમાં સદરહું ઉપરોક્ત પરિસ્થિતી માટે સમાજના સજ્જન વ્યક્તિઓની નિષ્ક્રીયતાનું પરિણામ જણાય છે.

શ્રી ક.ક.પા. સમાજના શુભ ચિંતક

realpatidar.com